

Seat No. : _____

MF-114

March-2022

M.A., Sem.- I

406 : Economics

(Environmental Economics – I)

Time : 2 Hours]

[Max. Marks : 50

વિભાગ – I

નીચેનામાંથી કોઈપણ ત્રણના જવાબ આપો :

42

1. નિવસનતંત્ર એટલે શું ? નિવસનતંત્રના પ્રકારો અને ઘટકોની ચર્ચા કરો.
2. બજારની નિષ્ફળતા એટલે શું ? પર્યાવરણીય વસ્તુમાં બજારની નિષ્ફળતા કયા કારણોસર ઉભી થાય છે ?
3. સમજાવો : (a) આદેશો અને અંકુશો, (b) સબસીડી.
4. વિનિમય યોગ્ય પ્રદૂષણ પરવાનાનો સિદ્ધાન્ત સમજાવો.
5. ટકાઉ વિકાસના ચાર મોડલ્સનું ટીકાત્મક મૂલ્યાંકન કરો.
6. ભારતમાં પર્યાવરણ જાતિને લગતા મુખ્ય કાયદાઓની ચર્ચા કરો.
7. પર્યાવરણીય કુઝનેટ રેખાનું ટીકાત્મક મૂલ્યાંકન કરો.
8. ‘મર્યાદિત વિકાસ’ અને શૂન્ય વિકાસની ખ્યાલનું ટીકાત્મક મૂલ્યાંકન કરો.

વિભાગ – II

નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ચારના જવાબ આપો :

8

1. પ્રણાલિકાગત અર્થશાસ્ત્ર અને પર્યાવરણીય અર્થશાસ્ત્રનો તફાવત બતાવો.
2. ‘સામુહિકતાની કરુણાંતિક’ એટલે શું ?
3. પ્રદૂષણ ઓછું કરવામાં ‘Price Reforms’ કઈ રીતે મદદરૂપ થઈ શકે ?
4. ‘અપૂર્ણ માહિતી’ એટલે શું ?
5. ‘પર્યાવરણીય અર્થશાસ્ત્ર’ની વ્યાખ્યા આપો.

Seat No. : _____

MF-114

March-2022

M.A., Sem.- I

406 : Economics

(Environmental Economics – I)

Time : 2 Hours]

[Max. Marks : 50

PART – 1

Attempt any **three** questions from the followings :

42

1. What is eco-system ? Explain the types and components of eco-system,
2. What is market failure ? Discuss the various reasons for market failure in environmental goods.
3. Explain : (a) Command & Control, (b) Subsidies.
4. Explain the tradeable pollution permit theory.
5. Critically evaluate four models of sustainable development.
6. Discuss the important legislation regarding environment policy in India.
7. Critically evaluate Environmental Kuznet Curve.
8. Critically evaluate the concept of 'Limited Growth' and Zero Growth.

PART – II

Attempt any **four** short questions from below :

8

1. State the difference between Traditional Economics and environmental Economics.
2. State the meaning of 'Tragedy of Commons'.
3. How 'Price Reforms' help in reducing pollution ?
4. What is 'asymmetric information' ?
5. Define 'Environmental Economics'.
